



RIDDHI CORPORATE SERVICES LIMITED

ISO 9001:2015, 27001:2013 & CMMI Level 3 Certified Company

CIN: L74140GJ2010PLC62548

DATE: - 16th February, 2022

To,
THE SECRETARY,
BOMBAY STOCK EXCHANGE LTD.,
25TH FLOOR,
PHIRBZE JEEJEEBHOY TOWERS,
DALAL STREET, MUMBAI -400 001,

BSE SCRIP CODE:- 540590 SYMBOL: RIDDHI CORP ISIN: INE325X01015

Dear Sir,

Sub: -Submission of newspaper advertisement as per Regulation 47 of SEBI (Listing obligation and Disclosure Requirements) Regulations, 2015.

Pursuant to the provisions of Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we are enclosing herewith the copies of Publication of the Un-Audited Financial Results in the Jai Hind (Gujarati News Paper and Ahmedabad Edition) and in Business Standard (English News Paper and Ahmedabad Edition) regarding the Un-Audited Financial Results of the company in the Board Meeting held on 14th February, 2022 for the Quarter and Nine Month ended on 31th December, 2021.

Kindly take the above information on your records.

Thanking you.

Yours Faithfully

For, Riddhi Corporate Services Limited

MUSTAFA M. SIBATRA
Company Secretary & Compliance Officer

Encl: As above

1. Paper of Jai Hind (Extract) - Gujarati
2. Paper of Business Standard (Extract) - English

Registered & Corporate Office: 10, Mill Officers Colony, Behind Old RBI, Opp. Times of India, Ashram Road,
Ahmedabad – 380009

Contact: 079 2658 0767 | Email: info@rcspl.net | Web: www.riddhicorporate.co.in

पंजाब नैशनल बैंक Punjab National Bank

CIRCLE OFFICE, SASTRA DIVISION 1ST FLOOR, SECTOR - 16, GH - 45 GANDHINAGAR - 382016. EMAIL: -cs8226@pnb.co.in

APPENDIX IV [See Rule 8 (1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the Authorised Officer of Punjab National Bank, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 04.12.2021 calling upon the Borrowers/Guarantors/Mortgagors **Mr. Chiragkumar Rameshbhai Sathwara and Mr. Bharatbhai Rameshbhai Sathwara** to repay the amount mentioned in the notice being **Rs. 33,65,711.84/-** (Rs Thirty Three Lakhs Sixty Five Thousand Seven Hundred Eleven and Paise Eighty Four) as on 30.11.2021 payable with further interest and expenses until payment in full, within 60 days from the date of receipt of the said notice.

The Borrowers/Guarantors/Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantors/Mortgagors and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this **10th day of February, the year 2022.**

The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The Borrowers/Guarantors/Mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank, for an amount being **Rs. 33,65,711.84/-** (Rs Thirty Three Lakhs Sixty Five Thousand Seven Hundred Eleven and Paise Eighty Four) as on 30.11.2021 payable with further interest and costs thereon until payments/realization in full.

Description of immovable properties

Plot No.09,R.S.No.88,Sarved Vill, Building Name "Ramdev Villa",Nr. Chaveli Nagar Society,Aerodrum Road,Mouje Nagapur,And District Mehsana

Date : 10.02.2022
Place : Mehsana

Authorised Officer
Punjab National Bank

Balmer Lawrie & Co. Ltd.
(A Government of India Enterprise)

SBU: Greases & Lubricants
Regd. Office: 21, N S Road, Kolkata - 700 001
P-42, Hida Road Extension, Kolkata - 700 083
CIN: L15482WB1924G010435. Website: www.balmerlawrie.com

Public Tender No. GLK/TE/21/273, dated 14.02.2022. Due date : 07.03.2022 (IST: 16:00 Hours)

Subject : For supply of Naphthenic Base Oil in tanker (bulk) at the Silvassa and Kolkata Plants

Balmer Lawrie & Co. Ltd. invites online bid for supply of Naphthenic Base Oil in tanker at the Silvassa and Kolkata Plants. For submission of e-bid as well as detailed terms & conditions, please visit our e-proc site : <https://balmerlawrie.eproc.in>. All / any corrigenda, addenda, time extension to the above tender shall be hosted on Balmer Lawrie websites only (www.balmerlawrie.com, <https://balmerlawrie.eproc.in>). Bidders should regularly visit these websites to keep themselves updated. For any queries, please contact e-mail : Mr. S. Ghosh, Asst. Manager (CP) Ph.: 00 91 33 24500129 e-mail : ghosh.subimal@balmerlawrie.com

NOTICE is hereby given that the Certificate(s) for the under mentioned Equity Shares of the Company have been lost / misplaced and the holder(s) / purchaser(s) of the said Equity Shares have applied to the Company to issue duplicate Share Certificate(s).

Any person who has a claim in respect of the said Shares should lodge the same with the Company at its Registered Office within 21 days from this date else the Company will proceed to issue duplicate certificate(s) to the aforesaid applicants without any further intimation.

Folio No.	Name of Shareholder	No. of Shares	Distinctive Nos. From - To	Certificate Nos. From - To
008107	Nilesh Rajnikant Shah & Rupal Nilesh Shah	100	5989201-5989300	59893

Nilesh Rajnikant Shah & Rupal Nilesh Shah
Dated: 16th February 2022

Name and Registered Office address of Company :
Bigshare Services Pvt. Ltd. (Unit : PG Folds Limited)
A/802, Samudra Complex, Off C. G. Road, Navrangpura, Ahmedabad - 380009.

How to Meet Decision Makers
without an Appointment

Grow your business with Business Standard – the smart choice to reach those who matter!

- 71% readers in NCCS A1 and A2
- 12 English, 6 Hindi editions: 1000+ towns
- 6 lakh registered users, 12 million unique visitors per month
- Print readers spend >15 min per day, digital >5 min per visit
- The most-read business medium in top B-Schools
- 150+ events every year

Write to sales@bsmail.in now, for a customised solution to your business requirements

Business Standard
Insight Out

[business-standard.com](https://www.business-standard.com)

SALASAR
Building a stronger future

SALASAR TECHNO ENGINEERING LIMITED
CIN: L23201DL2001PLC174076
Regd Office: E-20, South Extension 1, New Delhi-110049
Ph: +91-120-6546670; E-mail id: towers@salasartechno.com
Website: www.salasartechno.com

NOTICE OF POSTAL BALLOT AND REMOTE E-VOTING

NOTICE is hereby given pursuant to Section 110 and other applicable provisions of the Companies Act, 2013 read with Rule 22 of the Companies (Management and Administration) Rules, 2014 (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force) and in terms of the General Circular No. 14/2020 dated April 08, 2020 and General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 22/2020 dated June 15, 2020, the General Circular No. 33/2020 dated September 28, 2020 and the General Circular No. 39/2020 dated December 31, 2020 and General Circular No.10/2021 dated June 23, 2021 in relation to extension of the framework provided in the aforementioned circulars up to December 31, 2021 issued by the Ministry of Corporate Affairs (the "MCA Circulars") and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Postal Ballot notice seeking consent of the Members by voting through electronic mode ("e-voting/remote e-voting"), has been sent by e-mail to the members/Record of Depositors as on the Cut-off date i.e. February 04, 2022 for obtaining the approval of the Shareholders' in respect of the following business.

Sr. No.	Description of the Resolution
1	Re-appointment of Mr. Vijay Kumar Jain (DIN: 00281757) as an Independent Director

Voting Rights shall be reckoned on the paid-up value of shares registered in the name of the Member(s) as on the Cut-off date and any person who is not a member as on date should treat the Postal Ballot Notice for Information Purposes only. As required, the Company is pleased to offer E-voting facility as an option to all the Members, to enable them to cast their votes electronically. The Company has engaged Central Depository Services (India) Limited ("CDSL") as the agency to provide e-voting facility. The facility to exercise vote on postal ballot by e-voting, will be available for the following period:
Commencement of voting: Wednesday, February 16, 2022 (09:00 A.M. IST)
End of voting: Thursday, March 17, 2022 (5:00 P.M. IST)

During this period members of the Company holding equity shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. February 04, 2022 may cast their vote electronically. The members are requested to peruse the proposed resolution along with the explanatory statement and carefully read the instructions and cast a vote through e-voting facility not later than on Thursday, March 17, 2022 at 5:00 P.M. (IST). E-voting shall not be allowed after 5:00 P.M. on Thursday, March 17, 2022. The e-voting module shall be disabled by CDSL for voting thereafter. The Board of Directors of the Company has appointed Deepika Madhwal & Associates (ACS No. 31234, C.P. No. 14808), Practising Company Secretary, as the Scrutinizer for conducting the Postal Ballot and e-voting process in a fair and transparent manner. The Scrutinizer will submit his report to the Chairman & Managing Director of the Company or any other person authorized by him, after taking into consideration votes cast through e-voting. Based on Scrutinizer's Report, the result of the voting will be announced on or before Saturday, March 19, 2022 at the Registered Office of the Company and will be communicated to the stock exchanges. The result along with Scrutinizer's Report will be placed on the website of the Company at www.salasartechno.com and on the website of CDSL at www.evotingindia.com. The said results shall also be displayed on the Notice Board of the Company.

The Notice of Postal Ballot alongwith the instructions for voting is also available on the Company's website at www.salasartechno.com and at the relevant sections of the websites of the stock exchanges on which the shares of the Company are listed i.e. www.bseindia.com and www.nseindia.com. To enable participation in the remote e-voting process the Company has made appropriate arrangement with its Registrar & Share Transfer Agent for registration of email addresses in terms of the above-mentioned Circular. Pursuant to the aforesaid Circular issued by Ministry of Corporate Affairs, for remote e-voting for this Postal Ballot, shareholders who have not registered their email address may temporarily get their email address registered with the Company & Company's Registrar & Share Transfer Agent. Shareholders may write the request to compliance@salasartechno.com and mukesh@bigshareonline.com. Post successful registration of the email, the shareholder would get soft copy of the notice and the procedure for e-voting along with the User ID and Password to enable e-voting for this Postal Ballot.

You are requested to avail the remote e-voting facility by logging on to CDSL's e-voting System www.evotingindia.com. The Password and User ID for e-voting are as under:

EVSN (Electronic Voting Sequence Number)	USERID	Default PAN / Sequence Number
220211008	USE YOUR PAN	USE YOUR PAN

Electronic Voting Start Date and Time 16th February, 2022 (09:00 a.m.)
Electronic Voting End Date and Time 17th March, 2022 (5:00 p.m.)

In case there is any change in your registered email address, kindly update the same with your Depository. In case of any queries, you may refer to the user manual for shareholders available at the help sections of www.evotingindia.com or contact CDSL at the following toll free telephone number: 18002005533 or 022-22728153 or contact the Company.

For Salasar Techno Engineering Limited Sd/- (Rahul Rastogi)
Company Secretary

Place: New Delhi Date: 15.02.2022

PALLAVAA GROUP

BEFORE THE NATIONAL COMPANY LAW TRIBUNAL,
BENCH AT CHENNAI
CP (CAA)/63/CHE/2021
IN
CA (CAA)/39/CHE/2021

In the matter of Sections 230 to 232 and other applicable provisions of the Companies Act, 2013

In the matter of Scheme of Amalgamation between Sri Cheran Synthetics India Private Limited (Transferor Company) with Pallava Textiles Private Limited (Transferee Company) and their respective Shareholders and their respective shareholders and creditors.

Pallava Textiles Private Limited,
CIN: U17111TZ1995PT005909
Having its Registered Office at No.27C, Sankari Bay Pass Road, Pallipalayam, Erode, Tamil Nadu - 638006.

...Petitioner/ Transferee Company

NOTICE

Notice is hereby given that by an order dated 13th January 2022, the Chennai Bench of the National Company Law Tribunal has fixed the date of hearing of the Joint Company Petition filed by the Petitioner Company (Pallava Textiles Private Limited) under Section 230 to 232 of the Companies Act, 2013 for the sanction of the Scheme of Amalgamation between Sri Cheran Synthetics India Private Limited with Pallava Textiles Private Limited and their respective Shareholders and their respective shareholders and creditors, on the 10th March, 2022. Any person desirous of supporting or opposing the said Petition should send to the Petitioner's Advocates, notice of his intention, signed by him or his Advocate, with his name and address, so as to reach the Petitioner's Advocates not later than two days before the date fixed for hearing of the Petition. Where he seeks to oppose the Petition, the grounds of opposition or a copy of his affidavit shall be furnished with such notice. A copy of the Petition will be furnished by the undersigned to any person requiring the same on payment of the prescribed charges for the same.

Dated this 16th day of February, 2022

HARISHANKAR MANI
PAWAN JHABAKH
Counsel for the Petitioner
New No. 115, First Floor, Luz Church Road, Mylapore, Chennai - 600 004.

ICA INDIAN CRICKETERS' ASSOCIATION

Only formally recognised former Indian players' association in India.

Registered Office: No. 94, G Square, New BKC Office, Jashraj Road, Gholepore East, Mumbai - 400 017.
Ahmedabad Office: #144, 1st Floor, Shankarji Road, Navrangpura, Bangalore - 560 001. Phone: +91-80-265 2309
office@indiancricketersassociation.com | www.indiancricketersassociation.com | www.evotingindia.com | www.evotingindia.com

Notice is hereby given pursuant to Section 110 and 108 of the Companies Act, 2013 read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 read with Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020 and Circular No. 10/2021 dated June 23, 2021 and General Circular No. 20/2021 dated December 8, 2021 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") including any statutory modification(s) or amendments(s) thereto or re-enactment thereof for the time being in force, **Adoption of Indian Cricket Association ("ICA") Nomination Policy** by proposing for consideration by the members of the Company for approval by means of Postal Ballot by voting through electronic means ("remote e-voting").

- In compliance with the MCA Circular, the Company completed the dispatch of Postal Ballot Notice, by electronic means only on Tuesday, 15 February 2022 to all the members whose names appear in the Register of Member as maintained by the Company, respectively as at close of business hours on Friday, 11 February 2022 which is also the cut-off date and whose email address are registered with the Company. The said notice is also available on the website of the Company at www.indiancricketersassociation.com under the head "Stakeholder Info" and on the website of NSDL at www.evotingindia.com. The person who is not a member as on said cut-off date should treat this notice for information purpose only.
- Members whose names appeared on the Register of Members as on the Cut-off date are entitled to vote on the Resolution as set forth in the Postal Ballot Notice.
- In compliance with MCA circulars, the Company has provided only the remote e-voting facility to its Members, to enable them to cast their vote electronically. The communication of the assent or dissent of the members would take place only through the remote e-voting system. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating remote e-voting to enable the members to cast their Votes.
- The detailed procedure and instructions for remote e-voting are enumerated in the Postal Ballot Notice. Remote e-voting shall commence at 10:00 A.M. (IST) on Wednesday, 16 February 2022 and shall end at 5:00 P.M. (IST) on Thursday, 17 March 2022. The remote e-voting facility will be disabled for voting by NSDL upon expiry of the aforesaid voting period.
- Ms. Priti Sheth (FCS: 6833), Practising Company Secretary, M/s Priti J Sheth and Associates, has been appointed as the Scrutinizer for conducting the Postal Ballot in a fair and transparent manner.
- The result of the Postal Ballot will be announced on or before Tuesday, 22 March 2022 of remote e-voting and will be simultaneously displayed on the notice board of the Company at its Registered Office. The results will also be placed on the website of the Company and NSDL.
- In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Members and e-voting user manual for Members available at the download section of www.evotingindia.com or call on toll free no.: 1800 1020 990 / 1800 224 430 or send a request to Ms. Sarita Mote at evoting@nsdl.co.in
- In case of any queries related to postal ballot notice or in case any member whose name appears in the Register of Members as on the cut-off date, has not received the Postal Ballot Notice, he/she may write to Ms. Anika Das at manager@indiancricketersassociation.com

By the order of the Board
For Indian Cricketers' Association Sd/-
Hitesh Majumdar (Director)

Date: 15 February 2022
Place: Mumbai

DEMAND NOTICE

Under Section 13(2) of the Securitisation And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 (the said Act), read with Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002 (the said Rules), in exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the said Rules, the Authorised Officer of IIFL Home Finance Ltd. (IIFL HFL) (Formerly known as India Infoline Housing Finance Ltd.), has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the Borrower(s), to repay the amount mentioned in the respective Demand Notice(s) issued to them. In connection with above, notice is hereby given, once again, to the Borrower(s) to pay within 60 days from the publication of this notice, the amounts indicated herein below, together with further interest from the date(s) of Demand Notice till the date of payment. The detail of the Borrower(s), amount due as on date of Demand Notice and security offered towards repayment of loan amount are as under:-

Name of the Borrower(s)/Guarantor (s)	Demand Notice Date & Amount	Description of secured asset (immovable property)
Mr. Sandipkumar Bhatiya, Mrs. Vanitaben Gopalbhai Bhatiya (Prospect No. 927209)	14-Feb-2022 Rs. 6,96,175/- (Rupees Six Lakh Ninety Six Thousand One Hundred Seventy Five Only)	All that piece and parcel of the property being: Flat No. H-108, First Floor, Area Admeasuring 513 Sq. Ft., Shreeji Sharan Residency, Survey No. 408, Mehsana Gujarat
Mr. Dinesh Rameshbhai Dhuri, Mrs. Ratnaben R Dhuri, (Prospect No. 879328)	11-Feb-2022 Rs. 14,04,488/- (Rupees Fourteen Lakh Four Thousand Four Hundred Eighty Eight Only)	All that piece and parcel of the property being : E/306, Admeasuring 55 Sq. Yds., Vrundavan Flat, Vejalpur, Ahmedabad, 380051, Gujarat, India

If the said Borrowers fail to make payment to IIFL HFL as aforesaid, IIFL HFL may proceed against the above secured assets under Section 13(4) of the said Act, and the applicable Rules, entirely at the risks, costs and consequences of the Borrowers. For further details please contact to Authorised Officer at Branch Office : IIFL HFL Ahmedabad Commerce House, 4th Floor, Commerce House 4, Nr Shell Petrol Pump, Anandnagar Road, Pralahadnagar, Ahmedabad - 380051 and Safal Complex, Mehsana-384002/Corporate Office: IIFL Tower, Plot No. 99, Udyog Vihar, Ph-IV Gurgaon, Haryana

Place: Ahmedabad & Mehsana Date: 16.02.2022 Sd/- Authorised Officer, For IIFL Home Finance Ltd

BANK OF INDIA
Relationship beyond banking

New Cloth Market Branch:
Outside Rajpur Gate, Ahmedabad. Ph.: 079-22160258/1241
Email: clothmarket.ahmedabad@bankofindia.co.in

APPENDIX IV (RULE 8(1)) POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTY)

The undersigned being the authorized officer of the Bank of India, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 10-06-2019 calling upon the borrower **Shri Alpesh Govindbhai Patel (Proprietor of M/s. Uma Industries)** to repay the amount mentioned in the said notice being **Rs. 46,26,969.70** (Rupees-Fourty Six Lacs Twenty Six Thousand Nine Hundred Sixty Nine & Seventy Paise only) plus further interest within 60 days from the date of receipt of the said notice.

The borrower/guarantors having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken physical possession of the immovable property belonging to **Shri Alpesh Govindbhai Patel (Proprietor of M/s. Uma Industries)** described herein below in exercise of powers conferred on him/her under section 13(4) of the said Act read with rule 8 of the said rule on 12-02-2022.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower/secured debtor in particular and the public in general is hereby cautioned not to deal with the property immovable and any dealings with the immovable property will be subject to the charge of the Bank of India for an amount of **Rs. 46,26,969.70** as on 10-06-2019 and further interest thereon.

Description of the Immovable Property :

All that piece and parcel of the immovable property owned by Mr. Alpesh Govindbhai Patel - Situated at City Survey No. 1977 comprising of First Floor, Second Floor and Third Floor paiki Third Floor, admeasuring 70 sq. meters along with terrace rights and undivided share in land admeasuring 8.23 sq. meters having Municipal Tenement No. 0107-55-0554-0001-R and also identified as No. 1060 Mouje- Jamalpur-2 situate at Naran Gopal No Khancho, Lalbhai's Pole, Mandavi Pole, Manekchowk, Taluka: City in the Registration District- Ahmedabad and Sub District Ahmedabad-1 (City).

Boudary:
On the North by: Property being City Survey No. 1976 On the South by: Property being City Survey No. 1978
On the East by: Pole's Road On the West by: Stairs
Date : 12-02-2022
Place : Ahmedabad.

Sd/-
Authorised Officer,
Bank of India

RIDDHI CORPORATE SERVICES LIMITED
CIN: L74140GJ2010PLC062548
Regd. Office : 10, Mill Officers Colony, Behind Old RBI, Ashram Road, Ahmedabad - 380009.
Phone : (079) 26580767 Web : www.riddhicorporate.co.in E-Mail : Investor@rcspl.net

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON 31ST DECEMBER, 2021 (Figures in Lakhs)

Sr. No.	Particulars	Quarter ended 31/12/2021 (Unaudited)	Quarter ended 30/09/2021 (Unaudited)	Quarter ended 31/12/2020 (Unaudited)	9 Months ended 31/12/2021 (Unaudited)	9 Months ended 31/12/2020 (Audited)	Year ended on 31/03/2021 (Audited)
1	Total Income from Operations (Net)	3,293.74	2,671.40	2,396.71	7,760.56	6,171.05	8,980.10
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items#)	289.30	164.77	152.88	580.33	385.26	478.40
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	289.30	164.77	152.88	580.33	385.26	478.40
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	216.48	99.78	114.40	410.75	288.29	309.25
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	-	-	-	-	-	-
6	Equity Share Capital	1,137.50	1,137.50	1,137.50	1,137.50	1,137.50	1,137.50
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	-	-	-	-	-	-
	- Basic	1.90	0.88	1.01	3.61	2.53	2.72
	- Diluted	1.90	0.88	1.01	3.61	2.53	2.72

Notes : (1) The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of the Company at their respective meetings held on February 14, 2022.
(2) The above results for the quarter and half year ended on September 30, 2021 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.
(3) The format of the above results as prescribed in SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated 30th November, 2015 has been modified to comply with the requirements of SEBI's Circular dated 5th July, 2016, Ind AS and Schedule III [Division II] to the Companies Act 2013.
(4) The Managing Director reviews the operations of the Company as whole; hence there are no reportable segments as per Ind AS 108 "Operating Segments".
(5) The outbreak of Corona virus (Covid-19) globally and in India is causing significant disturbance and slowdown of economic activity. The company has evaluated its impact on its business operations and based on its review and current indicators of future economic conditions. The Company has taken into account the possible impacts of COVID-19 in preparation of the financial results, including but not limited to its assessment of liquidity, and going concern assumption, recoverable values of its financial and non-financial assets, impact on revenues and on cost budgets.

By Order - For, Riddhi Corporate Services Limited
Mustafa Sibtra
Company Secretary & Compliance Officer

Place : Ahmedabad
Date : 14/02/2022

ODISHA GRAMYA BANK
HO: Gandamunda, PO: Khandagiri,
Bhubaneswar-751030, Ph.No.: (0674)2353009/2353041

RFP for Empanelment of Interior Furnishing/ Carpentry Work At Branches/Regional Offices/Head Office

Odisha Gramya Bank invites RFP proposals from eligible /competent agencies for Empanelment of Interior Furnishing/ Carpentry Work at Branches/Regional Offices/Head Office situated in state of Odisha. For details logon our Bank's website www.odishabank.in. The last date for submission of tender paper is 18-03-2022 by 3.00 PM. General Manager

SBI SBI Magod Branch (02668), Magod - 396 020, Dist. Valsad. (Gujarat), Mob.: 76000 39376
Email : sbi.02668@sbi.co.in

[Rule 8(1)] POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, The undersigned being the Authorized Officer of the State Bank of India, Magod Branch under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a Demand Notice dated 29.11.2021 calling upon the Borrower **Mrs. Hansaben Satishbhai Mangela and Mr. Satishbhai Fakirbhai Mangela** repay the amount mentioned in the notice being **Rs.17,80,800.00** (Rupees Seventeen Lakhs Eighty Thousand Eight Hundred only) and interest from 29.11.2021 within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor and the public in general that the undersigned has taken Symbolic Possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on this 11th Day of February of 2022

The Borrower/Guarantor in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the State Bank of India for an amount of **Rs.17,80,800.00** (Rupees Seventeen Lakhs Eighty Thousand Eight Hundred only) and further interest from 29.11.2021, costs, etc. thereon.

DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that piece and parcel of Residential Flat No-302, Admeasuring 116.17 Sq. Mts on 3rd Floor, Suramy Residency-A, Building Constructed on city survey Property card No-4408 paiki, having its TP scheme No-2. Having its final Plot No.311 paiki, admeasuring 2833 Sq.Mts. original survey No.753/A/Paiki 8, undivided share in land admeasuring 59.03Sq.Mts. Situated at Valsad Ta and Dist. Valsad, standing in the name of Mrs. Hansaben Satishbhai Mangela and Mr. Satishbhai Fakirbhai Mangela. Bounded : On the North by Common Plot, On the South by adjoining Flat No-402, On East by Mahadev Nagar Road, On the west by adjoining Flat No-301

Mr. Rohit Soni
Authorised Officer & Chief Manager

Date : 11-02-2022 | Place : Magod

Saanvi Advisors Limited

Regd. Office : 304, Shopper's Plaza - V, Government Servants Co-Op. Housing Society Limited, Opp. Municipal Market, C.G. Road, Navrangpura, Ahmedabad - 380009. Phone No. : 079-48904153 CIN : L74140GJ1995PLC084205
Email : saptharishifin@gmail.com Website : www.saptharishi.in

EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTH ENDED ON 31ST DECEMBER, 2021 (Rs. in Lakhs)

Sr No	Particulars	Quarter ended on 31/12/2021 (Unaudited)	Nine Months ended on 31/12/2021 (Unaudited)	Corresponding 3 months ended in the previous year 31/12/2020 (Unaudited)
1	Total Income from Operations	7.52	42.83	17.08
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	2.07	26.89	10.71
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	2.07	26.89	10.71
4	Net Profit / (loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	1.55	24.39	8.33
5	Total Comprehensive Income for the period (Comprising Profit/ (loss) for the period (after tax) and other comprehensive Income (after tax)	1.55	24.39	8.33
6	Paid-up equity Share Capital	201.05	201.05	201.05
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings per Share (of Rs. 10/- each) (for continuing operations)	0.08	1.21	0.41
	(a) Basic	0.08	1.21	0.41
	(b) Diluted	0.08	1.21	0.41

Notes : (1) The above is an extract of the detailed format of the quarter and nine month ended Unaudited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The Full format of the unaudited Financial Results is available on the stock Exchange website - www.mse.in & company's website - www.saptharishi.in
(2) The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 14th February, 2022.
(3) The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the quarter and nine month ended on 31st December, 2021 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.
Place : Ahmedabad For, Saanvi Advisors Limited
Date : 14/02/2022 Roopesh Ved, Director - DIN: 01504998

